

Date: 7th September, 2020

To,
The National Stock Exchange of India Ltd.
Exchange Plaza,
Plot no. C/1, G Block,
Bandra-Kurla Complex
Bandra (E), Mumbai - 400 051.

To
Department of Corporate Services,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers
Dalal Street, Fort,
Mumbai - 400 001.

Scrip Code No. VADILALIND-EQ Scrip Code: 519156

Dear Sir,

Subject: Newspaper Advertisement - Notice of 36th Annual General Meeting, Remote E voting information and Book Closure etc.

Please find attached herewith copies of newspaper advertisements published in the Indian Express (English) and Financial Express (Gujarati), both newspapers having electronic editions, regarding e-Voting information for the 36th Annual General Meeting of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on record.

For VADILAL INDUSTRIES LIMITED

RtHatt

Ms. Rashmi Bhatt Company Secretary & Compliance Officer

FCAEBOOK USER BOOKED OVER PROVOCATIVE POSTS

The Ahmedabad Cyber Crime Cell has lodged an FIR against a Facebook user for allegedly posting provocative posts on social media with intent to cause disharmony. The Facebook user identified as Kiran Par (Singhal) has been booked under Indian Penal Code sections 153, 153A, 153B, 295A, 298 and 505 1(c).

Woman, 'lover' held for murder of husband

EXPRESS NEWS SERVICE AHMEDABAD, SEPTEMBER 6

AMMEDABAD. SEPTEMBER 8

A WOMAN and her male friend, who the police said is her lover, were arrested for allegedly nurdering her husband in Sarkhej area of Ahmedabad.

According to officials of Ahmedabad Detection of Crime Branch, the accused Knjal Patel (21) and her lover Amrut Rabari (31) were arrested on Sunday for allegedly nurdering 43-year-old Pramod Patel, a resident of Pranav Apartments in Ambawadi of Ahmedabad on the night of September 3.

"On the morning of September 4, the body of Pramod Patel was found from bushes near Force Motors service station at a deserted location in Sarkhej of Ahmedabad with grave injuries. The decased's wife and her lover had absconded from the day of nurder and using technical surveillance, we held them and questioned them after which they confessed to the crime, and RV Gobil Assistant

guestioned them after which they confessed to the crime," said BV Gohl, Assistant Commissioner of Police, Ahmedabad DCB.
"Pramod Patel has hat two divorces and Kinjal was his third wife, who was already in a relationship with Ahmet, Kinjal and Amrut hatched a conspiracy to kill Pramod. Amrut hired his friend Suresh from Rajasthan and one unidentified person for Rs 5 lakh to get Paramod murdered. On the night of September 3, Kinjal frist called Pramod and confirmed his location near Sarkhej and then informed confirmed his location near Sarkhej and then informed Amnut about it. At a deserted location in Sarkhej, Pramod's scooter was waylaid and Amnut, Suresh and the third person attacked him with sharp weapons and killed him. They then dumped the body and fled in the car," the ACP added.

While Kinjal and Amnut have been booked under Indian Penal Code Section 302 for murder and 114 for conspiracy, police are now looking for un wook looking for murder and 114 for conspiracy.

police are now looking for Suresh and the unidentified person in the case who remain absconding as of now.

In the Office of the Joint Charity
Commissioner, Mehsana, Division
First Hoor, Fast Intack Court Building
First Hoor, Fast Intack Court Building
Scheme Amalamation Application
Scheme Amalamation Application
No. 442039
Under Section 59A(2) of the Gujarat
Trust Rep No. A/2835/Mehsas
Trust Rep No. A/2835/Mehsas
Trust Rep No. E/195/Fa/Ahmedabad
Paglicentact/(Mandal Probludse prince)

in the matter may file his win statement with affidavit on or bedate 01/10/2020 at 12.00 am on white date fixed for hearing before the t Charity Commissioner Mehsans sion. Mehsans

Classifieds

PERSONAL

I Manish Patel S/O. Dashrathbhai R/o B/8,hargovan Park Society, Motera, Ahmedabad-380005 have changed my name to Manishkumar Patel

for all purposes. 0040547453-1

" IMPORTANT

RM Division, Corporate Office, Sector -10, Do New Delhi-110075

PUNJAB NATIONAL BANK INVITES ON LINE APPLICATIONS FOR RECRUITMENT OF 535 POSTS OF SPECIALIST OFFICERS detailed advertisement please visit the Bank's websitu w.pnbindia.in on or after 07.09.2020 OR refer to the Employmen vs.dated 12.09.2020.

ast date for submission of online application: 29.09.2020 DEPUTY GENERAL MANAGER (HRMD)

andhra pradesh medical services & infrastructure

vools die en 1 eeu Jaard en 20° 2 "Politicemen in 20° 21 Experience voor 20° 21 Experience 20° 21 Experience voor 20° 21 Experience voor 20° 21 Experience 20° 21 Experience voor 20° 21 Experience voor 20° 21 Experience 20° 21 Experience voor 20° 21 Experience voor 20° 21 Experience 20°



Rajoo Engineers Limited

Regd. Office: Junagadh Road, Manavadar-362 630. Dist. Junagadh

Corp. Office : Rajoo Avenue, S Plot No.1, Indust Survey No.210 Veraval (Shapar), Rajkot - 360 024. CIN: L27100GJ1986PLC009212

Phone: +91-97129-62704-52701 Fax : +91-2827-252700 Fax : +91-2827-2527 E-mail : rel@rajoo.com Web : www.rajoo.com



EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT THE QUARTER ENDED 30TH JUNE, 20:

(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended
		30.06.2020 (Un-Audited)	31.03.2020 (Audited)	30.06.2019 (Un-Audited)	31.03.2020 (Audited)
1	Total Income	2458.88	2579.91	1978.19	9369.42
2	Net Profit Before Tax*	190.46	-14.55	30.36	159.87
3	Net Profit After Tax*	138.56	14.19	24.83	146.71
4	Total Comprehensive Income for the period [Comprising Profit/Loss for the period (after tax) and Other Comprensive Income (after tax)]	138,56	18,58	24,83	151,10
5	Paid up Equity Share Capital (Face Value of Re.1 Each)	615.31	615.31	615.31	615.31
6	Reserve (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)				6142.68
7	Earnings per share (before and after extraordinary items) (Face Value of Re.1/Share)				
	(a) Basic	0.23	0.02	0.04	0.24
	(b) Diluted	0.23	0.02	0.04	0.24

Note: The above is an exceptionar / excraorinary item ouring the Quarter Ended June 30, 2020 Note: The above is an extract of the detailed format of Cuptarrly Financial Results filled with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterfly/yearly Financial Results are available on the Stock Exchange weekstel (eww.bsenidi.com) and on the company's websile few.wr.vaioo cnm).

For & on behalf of Board of Rajoo Engineers Limited

K.P. ENERGY LIMITED

CIN: L40100GJ2010PLC059169

Regd. Office: 'KP House', Opp. Ishwar Farm Junction BRTS, Near Bliss IVF Circle:
Canal Road, Bhatar, Sural-385017, Gajarat.

Tel & Fax: (0261) 2234757 E-mall: info@kpenergy.in Website: www.kpenergy.in

NOTICE TO THE SHAREHOLDERS OF 11TH ANNUAL GENERAL MEETING

NOTICE TO THE SHAREHOLDERS OF 11TH ANNUAL GENERAL MEETING NOTICE is honely given that the 11th Annual General Moeting ("AGM") of Members of K.P. Energy Limited will be held on Tuesday, September 29, 2020 at 03:00 p.m. through Video Coefference ("VC") / Chinr Addio Vauali Means ("OAVM") to transact the businesses as set out in the Notice convening AGM on September 05, 2020, through electronic mode to the Members whose email addresses as re-replaced with the Company and / or Depositories in accordance with the Circilar issued by the Ministry of Comporate Malies Discussed in Accordance with the Circilar issued by the Ministry of Comporate Malies Discussed in Accordance with the Circilar issued by the Ministry of Comporate Malies Discussed in Accordance with the Circilar issued by the Ministry of Comporate Malies Discussed in Circular No. 20/2020 dated May 5, 2020 read with its circulars No. 14/2020 dated April 13, 2020 and Securities & Exchange Board of India Circular No. SEBHTOICE DISCUSSING/PS/20207/9 dated May 12, 2020. The Annual Report along with the Notice convening the AGM available on the website of the Company at www.keperiagy.in and on the website of the Company at www.keperiagy.in and on the website of Central Depository Services (India) Limited ("CDSL") at www.evoingindia.com.

available on the website of tecompany at www.kpenergy.in and on the website of Central Depository Services (India) Limited (CDSL*) at tww.evolingindis.com.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act. 2013 ("Act") and the applicable rules fremed theteunder that the Register of Members & Share Transfer Books of the Company will remain closed from September 21, 2020 to September 29, 2020 (solit days inclusive) for the purpose of 1th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system ("evoling") provided by CDSL. The voting applies of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on September 18, 2020 ("cut-off date"). The remote e-voting produce shall be disabled by CDSL thereafter. Those Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VCOAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not bared from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also strend/participate in the AGMs through VC/OAVM but shall not be entitled to cast their

votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date, may obtain the login ID and password by sending a request to helpdock-evoting-glodsfindia.com. Howeverif helpfale is altered registered with CDSL for remote e-voting, helpfale can use histher existing User ID and password for casting the votes. In case of any queries perfaining to e-voting, members may refer to the Frequently Asked Coustions ("FACS") and the e-voting memula available at www evotingindia.com, under help section or contact at lell free number 1809/225531, (n. case of any griovances relating to e-voting, please contact, Mr. Rakesh Daini, Manager, at 25th Tibor. A Wing, Marathon Futures. Materials Mills Compound, Wh. Joshi Manager, at 25th Tibor. A Wing, Marathon Futures. Materials Mills Compound, Wh. Joshi Manager, at 25th Tibor. A Wing, Marathon Futures. Materials Mills Compound, Wh. Joshi Mang, Lower Parel (E), Murbai-400013, Email, helplossk-evoting@pdslindia.com or aforesaid toil tree number.

The details of the AGM are available on the websile of the Company at www.kpenergy.in CDSL at www.evotingmdia.com, and BSE Limited at www.bseindia.com.

For K.P. Energy Limited

Place : Surat Date : September 07, 2020 Karmit Sheth Company Secretary & Compliance officer





The Indian **EXPRESS**

WHERE **NEWSMAKERS** DROP IN FOR A CANDID CHAT.



Express E-Adda hosts

Dr. S. Jaishankar External Affairs Minister, Government of India

in conversation with

C. Raja Mohan

Contributing Editor, The Indian Express and Director - Institute of South Asian Studies, National University of Singapore

Shubhajit Roy

Associate Editor and Diplomatic Correspondent, The Indian Express

By invitation only

InCred Wealth

Wealth Partner Join the conversation.

Associate Partners

AIRBUS



Ndianexpress.com

exclusively on:

twitter.com/IndianExpress

facebook.com/IndianExpress

Join us on Zoom

VADILAL INDUSTRIES LIMITED Vadilal

Regd. Office: Vadilal House, Shrimali Society, Nr. Navrangpura Rallway Crossing, Navrangpura, Ahmedabad - 380009. : 079-26564019 to 24, Fax: 26564027, Web: www.vadilalgroup.com V: L91110GJ1982PLC005169, Email: shareslogs@vadilalgroup.com

NOTICE OF THE 36TH ANNUAL GENERAL MEETING, BOOK-CLOSURE AND REMOTE E-VOTING INFORMATION.

NOTICE is hereby given that the 36" Annual General Meeting ("AGM") of the members of the Company will be held on **Wednesday**, the 30" **September**, 2020 at 11,00 a.m., through Video Conferencing ("VCP") 'Other Audio Visual Means ("OAVM") to transact the business as set ou in the Notice of AGM dated 31" August, 2020.

in the Notice of AGM dated 31" August, 2020.

In view of continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs (MCA) has vide its circular dated May 05, 2020 read with Circular dated April 08, 2020 and April 13, 2020 (collectively referred as "MCA Circulars") permitted holding of AGM through VC or OAVM, without the physical presence of Members at a common venue, in compliance with these MCA Circulars and the relevant provisions of Companies Act, 2013 along with SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Annual General Meeting of the members of the Company will be held through VC/ OAVM. Members can attend and participate in the AGM through VC/ OAVM facility. The instructions for joining the AGM are provided in the Nottee of the AGM are provided in the Nottee of the AGM. Members attending the Meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

2013.

In compliance with the Act, the Rules made there under and the above Circulars, the Company has sent Notice of 36° AGM. E-Voting Instructions and Annual Report for Financial Year 2019-20 on 5° September, 2020 through Electronic Mode to those shareholders whose E- Mail address are registered with the Company or Registrar & Share Transfer Agent or Depository Participant(s). The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with vide MCA Circulars and SEBI Circulars. The Annual Report for the Financial Year 2019-20 including the Notice of AGM shall also be made available on the Company's website at www.uscindia.com respectively and on the website of Stock Exchanges at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at www.uscindia.com

CDSL 1at wave colliminations.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44(1) of SEBI (Listing Obligations and Disdosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide to its Members the facility to cast their votes by electronic means (remote e-voting) on all the resolutions set forth in the Notice through Central Depository Services (India) Limited (CDSL). The remote e-voting priord commences on Sunday, 27% September, 2020 (9:00 pm), and and ends on Tuesday, 29th September, 2020 (9:00 pm). During this period and at the time of Annual General Meeting, shareholders of the Company cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. The voting rights of members shall be in proportion to their shares of the paid up equity share capital of the Company as on the cut-off date La. 22nd September, 2020, Any parson, who acquires shares of the Company and become member of the Company after dispation of the notice and holding shares as of the cut-off date La. 22nd September, 2020, may obtain the login ID and password by sending a request at hepidesk evoluting &cdslindia.com. Members attending the AGM who have not cast their votes by Remote E-voting shall be

Company or Registrar or Share Transfer Agent or Depository Participant.

Members attending the AGM who have not cast their votes by Remote E-voting shall be eligible to cast their votes by Permote E-voting shall be eligible to attend the AGM. However, they shall not be eligible to vote at the meeting. The procedure of electronic voting (evoting) is available in the Notice of the AGM. NOTICE is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013, Rules 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation, 42 of SEBI (Listing Obligations and Discbsure Requirements) Regulations, 2015 that the Register of Members and Share Transfer Books of the Company will remain dosed from 21* September, 2020 to 30* September, 2020 to 10* September, 2020 (both days inclusive) for the purpose of Annual General Meeting for the year ended on 31st March, 2020.

In case you have any queries related to attend the Meeting or issues regarding e-voting, you may write an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

The contact details of the person responsible to address the grievances connected with the voting by electronic means is as under:

Mrs. Rashmi Bhatt, Company Secretary, Phone : 079-48081200, Email : shareslogs@vadilalgroup.com

By order of the Board For Vadilal Industries Limited Sd/-Rajesh R. Gandhi Managing Director

Place: Ahmedabad Date: 05-09-2020

Ahmedabad

Asahi Songwon Colors Limited

વીસી / ઓએવીએમ દ્વારા રાખવામાં આવતી ૩૦મી વાર્ષિક સામાન્ય સભા સંબંધિત કંપનીના अक्योने नोटीअ

કંપની અધિનિયસ, ૨૦૧૩ ના નિયમો અને તેના કેઠળ ઘટવામાં આવેલા નિયસો અને રોબી (લિલ્ટિંગ કરાર અને લાહેરાત જરૂરીલાતી) નિયમન, ૨૦૧૫ ની સામાન્ય એગ્લાઈઓ, કોપોરેટ બાબતોના મંત્રાલય ("એમસીએ અર્ધુલર") દ્વાર લાંગી રાયોલા પરિયન નેબરો, ૧૪/૨૦૨૦, ૧૯/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ અનુક્રમે ૦૮, એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૦૫ મે. ૨૦૨૦ અને પરિયન નેબર્ટ, સેબી / એચએમ, / સીએડો / સીએડો ૧ / સીબાઈબર / પી / ૨૦૨૦/૦૯ તા. ૧૨ મેં, ૨૦૨૦ એ અને પરિષ્ય નવદ રોવ્યી / એએમાં / સીએકડી / સીએવડી ૧ / સીઅડિબાર / પી / 2070/છંદ તા. ૧૬ મેં, 2070 એ ભારતીય સિમોડિંગ અને અક્ષ્યલેલ ખેડ ('તેઓ પરિષ્ય') પૂજના આર્ધી નોહેલ આપવામાં આવે છે. અસાદિ સોંગલોન કહ્મર્સ હિમિટેડ ('કંપની')ના સલ્યોની 30મી વાર્ષિક સામાન્ય સભા ('એહબેમ') બુધવાર, તા. 30 સપ્ટેમ્બર, 2070 ના રોજ 13. 13. 30 વાર્ચે એક્બેમ નોહિરમાં દ્વાવિલ કાયકાજ કરવા માટે વિડિઓ કોર્મિન્સને ('વીમી') અથવા અન્ય ઓડિયો વિઝ્યુબલ મીના ('OMM')થી વાર્ષિક સામાન્ય સભાના સ્થળ પર તળાંની શારીકે ઉપસ્થિતિ વિના બોલવવામાં આવશે. એમસીએ પૈપિય/ એમીના પરિપય અનુસાર 30મી એક્બેમની નોટીશ અને નાણાકીય વર્ષ ૨૦૧૯ ન્૨૦ મોટને વાર્ષિક અહેવાલ ('વાર્ષિક અલેવાલ) ને વર્ષા પ્રત્યાને કંઇક્ટ હાર મોકલવામાં આવશે, જેમના કંમેકેલ આર્ડી કંપનીમાં અથવા તેમના સંબંધિત ડિયોડિટરી પાર્ટિસિપર ('દિપોડિટરી') સાથે નોંધાયેલા છે.

જે સભ્યોએ અત્યાર સુધીમાં ડિપોઝિટરીઝ / કંપની / રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ ("આરટીએ") સાથે પોતાના ઈમેઈલ આઈડી રજીસ્ટર કર્યા નથી. તેઓને નીચેની રીતે તેમના ઈમેઈલ આઈડીને નોંધણી / અપડેટ કરવા વિનંતી છે.

- (૧) ઈલેક્ટ્રોનિક / ડિમેટ હોર્લ્ડિંગ્યના સંદર્ભમાં સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ડિપોઝિટરી પામે. જો કે, સભ્યોના નાય, ડીપી આઈડી, ક્લાપેટ આઈડી, પાન, યોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડીની વિગતો કંપનીમાં cs@asahisongwon.com પર અસ્થાયી રૂપે તે નોંધણી કરાવી શકે છે.
- (૨) પ્રત્યક્ષ સ્વરૂપે શેર ઘરાવતા સભ્યો કે જેમણે પોતાનો ઈમેઈલ આઈડી કંપની / ડિપોડિસ્ટરીમાં નોંઘાવ્યું નથી, તેઓ 30મી એજીએમની નોટિસ, વાર્પિક અહેવાલ / વીર્સી / ઓએવીએમ સુવિધા દ્વારા 30મી એજીએમાં જોડાવા માટે લોગિન ની વિરાતો નીચે આપેલા દસ્તાવેઓની સ્કેન કરેલી કોપી ઈમેઈલ દ્વારા @@asahisongwon.com પર મોકલીને મેળવી શકે.
- (અ) એક સહી કરેલ વિનંતી પત્ર જેમાં તમારું નામ, ફોલિઓ નંબર અને સંપૂર્ણ સરનામાંનો ઉક્ષેખ હોય.
- (બ) પાનકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી કોપી.
- (ક) કંપનીમાં નોંધાયેલા સભ્યના સસ્નામાંના સમર્થનમાં કોઈપણ દસ્તાવેજની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી કોપી (જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, ચૂંટણી ઓળખ કાર્ડ, પાસપોર્ટ)

સભ્યો કરત વીસી/ઓએવીએગ સુવિધા દ્વારા જ ૩૦મી એજએમમાં જોડાઈ અને ભાગ લઈ શકે છે. કંપની દ્વારા નેશનલ સેક્યુરિટીર ડિપોઝિટરીઝ લિમિટેડ ("એનએસડીએલ") સાથે ઈ–બોર્ટિંગની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૦મી એજીએમમ ડિપાડિટરોડા હિલાર્ટડ 'અનન્યસંદાબલ') સાથે ઇ-વાટિંગની સુધિયા માટે જુરી બલસ્થી કરવામાં આવા છે. 30માં અછે અરમા એડાંટામાં સુધ્યા એ કંગ્રમી એક્ઝએ તરિયાન દિવારે દરિક્રેડીએ અદાવતા એ લેવાની સ્થાવ દેવાની દરિક્રાસ ત્યાર તેનારા સભ્યોની ગણતદી કેપની અધિનિષ્યા, ૧૦૧૩ ની કહામ ૧૦૩ અંતર્ગાંત ક્ષેત્રમ ની ગણતદીના હેતુ માટે કરવામાં આવશે. ૩૦મી એક્ઝએમની નોટિંસ અને વાલિક એલ્લાવ પણ કંપનીની વેબનાઇટ હેલ્ટ કે www.asalinsongno.com અને નીએસઇ વેબસાઇટ એટલે કે www.bseindia.com પર અને એનએસઇની વેબસાઇટ હેલ્ટ કે www.nseindia.com પર ઉપલબ્ધ ઇટ

. ૩૦મી એજીએમ હેતુ માટે કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સકર બુક ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦થી બુધવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ (બને દિવસ સહિત) બંધ રહેશે.

ઉપરોક્ત માહિતી કંપનીના તમામ સભ્યોની જાણ અને લાભ માટે જારી કરવામાં આવી છે અને એમસીએ પરિપત્ર અને સેબીન પરિપત્રનું પાલન કરે છે. અમાક્રિ સોંગવોન કલર્સ બિબ્રિટેક વર્તી અસાહિ સોંગવોન કલર્સ લિમિટેડ વતી.

તારીખ: ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૦

શ્રીમતી પારૂ એમ. જયકિશ્ના

કે.પી. એનર્જુ લિમિટેડ CIN: L40100GJ2010PLC059189 રજીસ્ટર્ડ ઓફીસ: 'કેપી લાંધર', ઇચાર ફાર્મ જંકવાન લી.આર.ટી.એસ.ની સામે, બ્લીસ આઇવીએ સર્જલની પાસે, લેનાલ રીક, ભારાર, સુરત-૩400મ,, ગુજરાત, ભારત. ટેલિફોન/કેકસ: (૦૨૬૧)૨૨૩૫૫૫ ઇ-મેઇલ: Info@kpenergy.in વેબસાઇટ: www.kpenergy.l

૧૧મી વાર્ષિક સાદારણ સભાના સભ્યોને નોટીસ

વર્મી વાર્ષિક સાદારાશ સભાવા સભ્યોન નોરીસ આવી લોટીસ આપવામાં આવે છે કે, કે.પી એનાલું લિમિટેકના સભ્યોને વર્મા વાર્ષિક સાદારણ સભા (એન્રુપ્રોમ) મંગળવાર રસ્ત્રી ત્રાયેક્ક્સ, ૨૦૨૦ના રોજ લાપીક ૩૦૦ કલાઇ વીકીઓ કોન્ડ્રસ્ત્ર ('વીક્રી') અન્ય ઓક્સો લિકોઓ માદ્યમ ('ઓએવીએમ') કારા ચોળવો, જેમાં એપ્ડુએમની લોટીસમાં દર્શાવવામાં સાલા સુજલના કાર્યો હાથ કરાતે. મિનિસ્ટ્રો અને કોર્પાયેટ અફર્સના, પરિપ્ર તં. ૧૪/૨૦૨૦ તા. દર્મી એપ્ડિલ ૨૦૨૦, પરિપત્ર તં. ૧૫/૨૦૨૦ તા. ૧૩મી એપ્ડિલ ૨૦૨૦ અને પરિપ્ર તં. ૨૦/૨૦૨૦ તા. પત્રી મે ૧૦૨૦ તથા સિક્યોરિટોઝ અને એક્સ્ચેજ બોર્ડ એફ ઇન્ડીસાના પરિપ્ર તોન્ડ ૨૯૩માનિ (પ્રાપ્ત ક્લાઇ) ત્રાયેક્ક પ્રાપ્ત કર્મા એક્સ્ચેજ બોર્ડ ઓફ ઇન્ડીસાના પરિપ્ર લોટીસ અને વાર્ષિક અર્ટવાલ વિકેટ્સનિક મોકથી જે સભ્યોના વે-મેઇલ આવી આપવામાં આવ્યા છે. એજીએમાની લોટીસ તથા વાર્ષિક અર્દેવાલ ઇપ્લોની વેઠાસાઇ www.kpenergy.in તથા સેન્ડ્ર્સ કિપ્યોગીસ્ટી સાર્વિકાલ(બેનીઅ) લિમ્લેટની વેઠાસાઇ www.cpenergy.in તથા સેન્ડ્રસ્ત્ર અર્ચના ક્લાઇસ પ્રાપ્ત પ્રત્યાના પ્રાપ્ત પ્રત્યાના હોંક્સ અર્થના ક્લાઇસાલ પ્રત્યાના ક્લાઇસ્ટના સ્ત્રાયના વાર્ષિક અર્દ્રના સ્થાન પ્રત્યાના ક્લાઇસાલ ક્લાઇસાલ પ્રત્યાના ક્લાઇસાલ ક્લાઇસ

કંપનીની ઘારા, ૨૦૧૩ની કલમ ૯૧ હેઠળની જોગવાઈએ તેમજ તે મુજબ ઘડાઢેલા નિયમે અન્વહે આથી એ બાલતે પણ નોદીસ આવે છે કે કંપનીના સભ્યોનું રણસ્ટર તથા શેર ફ્રોન્કફર લુક્સ સ્પર્મ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૯મી સપ્ટેમ્બર ૨૦૨૦(બને દિવસો સહિત) ૧૧મી એજીએમના હેતુઓ બંધ રહેશે.

કંપલીંગ એક્ટરની કદભ ૧૦૮ની જેગવાંઇથો તથા સુધારા સહિતાના કંપલી/(બેલેગમેન્ટ એક્ટર્કિસિસ્ટ્રેશન) રૂલ્સ, રુપમાના સિસ્ટાના કંપલીંગ) (બેલેગમેન્ટ એક્ટર્કિસિસ્ટ્રેશન) રૂલ્સ, રુપમાના સિસ્ટાના રહેલાંગ) રહેલા, રુપમાના સિસ્ટાના સ્ટેલ્સિસ્ટ્રેશનો એક્ટર્કિસિસ્ટ્રેશનો એક્ટર્કિસિસ્ટ્રેશનો એક્ટર્કિસિસ્ટ્રેશનો એક્ટર્કિસિસ્ટ્રેશનો એક્ટર્કિસ્ટર્સિસ્ટ્રેશનો સિસ્ટ્રેલિસ્ટ્રેશનો સ્ટિસ્ટર્સિસ્ટ્રેલિસ્ટ્

રહવા તરાશા તેવલા તાવવાના આપાર હતાવાડન રાગાન, કર્ય કર આદ તાલભ તે પ્રત્યા કરો છતે. કિમોર ઇ-વીડીઆ સમસગાળાની શરૂઆત ૧૬મી શાર્ચેમ્પર ૧૨૨૦ સવારે ૧૦:૦૦ થી થશે અને ૨૮મી સપ્ટેમ્પર ૨૦૨૦ના રોજ સાંજે પા૦૦ એ પુર્વી થશે. આ સમસગાળા દરમિયાન, સભ્યો ઇલેક્ટ્રોબિકલી મત આપી શકશે. એ પછી સિમોર ઇ-વોડીંગ મોક્યુલ ક્રિસેમલ કરી દેવારો. સિમોર ઇ-વોડીંગની ઉલ્લ્ડ બાર્ક ઉપયોગ કર્યો હોય અને જે રહ્યો એમુએમમાં વીસી/ઓએપોયમ પ્રારા હાજર ૨૯થા હત્રો તે સભ્યો એમુઓમમાં ઇલિક્ટ્રોબિક સિસ્ટમ દારા મત આપી શકશે.

એકવાર સબ્લે કોઇ એક કરાવ ઉપર રિમોટ ઇ-વોર્ટીગ દ્વારા મત આપી દિદ્યો હોય તો તેઓ વીસી/ ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ લઇ શકરો, પણ તેમને એજીએમમાં ફરીથી મતદાન કરવાની મંજુરી

મળશે નહીં. સભાની નોદિસ મોકલી આપ્યા પછી કોઇ વ્યક્તિન કંપનીની સભ્ય બની ક્ષેય અને તેઓ કર-ખોક તારિખના દિવસે શેર્સ ધરાવતી હોય તો તેઓએ helpdesk.evoting@cdslindia.comને ઇ-મોઇલ્સી વિનંતી કરી ચૂગર આર્ધકી તથા પાસવર્ડ પાપ્ત કરવાના રહેશે. શ્રેફે એ વ્યક્તિ સિર્ડાએસમેલ સમસ ઇ-પોર્ટીગ માટે આર્પીકી જ તોવારેલી હોય તો, તએ પોતાના એજ યુગર આર્ધડી તથા પાસવર્ડના ઉપયોગથી પોતાનો મત આપી શકે છે.

હૈપલોગલી પોતાનો મત આપી શકે છે. ઇ-વોર્ટીંગ સંબંધિત કોઇ પણો હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્ય સેકરાનામાં (કીકવન્ડની આસ્કક કરોગ્રસ) 'FAGs' (સવાર નવાર પુછાતા પશ્ની)નો અને ઇ-વોર્ટીંગ મેન્યુઅલનો ઉપયોગ કરી લઈ છે સ્થયા helpdesk.evoting@cdslindia.com પર ઇ-મેલા કરી શકે છે અથવા ટોસ કો નંબર '૨૦૦૨૨૧૫૩૩ પર ફોના કરીને જાણકારી મેળી શકે છે. ઇ-વોર્ટીંગને લગતી કોઇપણ કરીયાદ હોય તો, ની શકેશ દલવી, મેનેજર, સેન્દ્રલ ડિપોઝરરી સર્વિસીસ (ઇન્ડીંચા) રિવિપ્ટેંડ, સે વિંગ, રખમે માળ, મેરેચોન સ્થૂચર, મફતલલલ લિલ કમાઉન્ફર, એક્ત,એમ. સેવી માર્ગ, લોએર, પરેલા(પુત્ર), મુંબઈ - ૧૦૦૦૧૬ નો સંપર્ધ ઇ-મેઇલ: helpdesk.evoting@cdslindia.com અથવા ઉપરોક્ત ટોલ કો નંબર ઉપર કરી શકારો.

એજીએમને લગતી માહિતી કંપનીની વેબસાઈટ www.kpenergy.in સીડીએસએલની વેબસાઈટ: www.evotingindia.com તથા સ્ટોક એક્સરોન્જની વેબસાઈટ www.bseindia.com પર પશ ઉપલબ્ધ છે.

કે.પી.એનર્જી લિમિટેડ વતી

बतः संडप તારીખઃ ७ સપ્ટેમ્બર, ૨૦૨૦

The Indian Express. For the Indian Intelligen

કર્મિત શેઠ કંપની સેકેટરી અને કમ્પ્લાઈન્સ ઓફીસર



♦ The Indian EXPRESS

NOTICE: is hereby given that a meeting of Board of Directors of the Company is shedule to be held on Monday. September 14, 2020 at 4.00 P.M at 168, Judges Court Road, Kolkata-700 027, West Bengal, "To consider and approve, inter alia, the Un-Audited Financial Results of the Company for the Quarter ended June 30, 2020".

ne 30, 2020".

this connection as per the Company's Code
Conduct for Regulating, Monitoring &
sporting Trading by Insiders, the trading
dow which was closed for trading by
signated persons from July 1, 2020 will now
main closed till September 16, 2020.

For The Indian Wood Products Co. Ltd e: Kokata Anup Gupta : 06.09.2020 Company Secretar Anup Gupta Company Secretary

AksharChem (India) Limited

♦ The Indian EXPRESS

વીસી / ઓએવીએમ દ્વારા રાખવામાં આવતી ૩૧મી વાર્ષિક સામાન્ય સભા સંબંધિત કંપનીના સભ્યોને નોટીસ

કંપની અધિનિયમ, ૨૦૧૩ ના નિયમો અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને સેબી (લિસ્ટિંગ કરાર અને જાહેરાત કંપની ઓધીમાંગ્ય, ૨૦૧૩ ના મિચ્યા અન તેના હજા ઘડવામાં આવવા મંગવા અને સંગી (લીક્ટર) કરાર અને બહેરત જરૂપીસાનો નિયમન, ૧૦૧૧ ની સામાન્ય જેગાઈઓ, લોકોંગ્ય, ખાવેનામાં ગાંધ 'વેપ્તમોની અધુર્ધ' કહાર અને કાર્યો પ્રદેશન તેનો, ૧૪/ ૧૦૦૦, ૧૭ ગેઠિવ, ૨૦૧૦ અને ૧૫ મે. ૧૦૧૦ અને ૧૫ મે. ૧૦૧૦ અને ૧૫ મે. ૧

એમસીએ પરિપત્ર/સેબીના પરિપત્ર અનુસાર ૩૧મી એજીએમની નોટીસ અને નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦ માટેનો વાર્ષિક અહેવાલ ('વાર્ષિક અહેવાલ') તે બધા જ સભ્યોને ઈમેઈલ દ્વારા મોકલવામાં આવશે, જેમના ઈમેઈલ આઈડી કંપનીમાં અથવા તેમના સંબંધિત હિપોડિટરી પાર્દિસિપન્ટ ('ડિપોડિટરી') સાથે નોંધાયેલા છે.

જે સભ્યોએ અત્યાર સુધીમાં ડિપોઝિટરીઝ / કંપની / રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ ("આરટીએ") સાથે પોતાના ઈમેઈલ આઈડી રજીસ્ટર કર્યા નથી. તેઓને નીચેની રીતે તેમના ઈમેઈલ આઈડીને નોંધણી / અપડેટ કરવા વિનંતી છે.

- ડાડા રાજભર કચા નથા. તભાન માનવા સાત તમના કમાંગ આઠાન નાયલા / બપડ કચા ધરનાતા છે. (૧) ઈલેક્ટ્રીનિક / ઉમેટ હોલ્ડિંચના મંદર્ભમાં સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિયન્ટ દ્વારા ડિપોઝિટરી પાસે. જો કે, સભ્યોના નાગ, ડીપી આઈડો, ક્લાયંટ આઈડી, પાન, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડીની વિગતો કંપનીમાં cs@aksharchemindia.com પર અસ્થાયી રૂપે તે નોંઘણી કરાવી શકે છે.
- (૨) પ્રત્યક્ષ સ્વરૂપ શેર ધરાવતા સત્યો કે જેમણે પોતાનો ઈમઈલ આઈડી કંપની/ ડિપોપ્રિટરીમાં નોંધાવ્યું નથી, તેઓ ૩૧મી એક્કએમની નોટિસ, વાર્ષિક અહેવાદ / વીલી / ઓએવીએમ સુવિધા દ્વાર ગમી એક્કએમાં ક્ષેડાવા માટે લીગિન ની વિસ્તો નીચે આપેલા દરતાયેઓની સ્કેન કરેલી કોપી ઈમેઈલ દ્વારા દર@aksharchemindia.comપર મોકલીને મેળવી
- (અ) એક સહી કરેલ વિનંતી પત્ર જેમાં તમારું નામ, ફોલિઓ નંબર અને સંપૂર્ણ સરનામાંનો ઉક્ષેખ હોય
- (બ) પાનકાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી કોપી.
- (ક) કંપનીમાં નોંઘાયેલા સલ્યના સરનામાંના સમર્થનમાં કોઈપણ દસ્તાવેજની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી કોપી (જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, ચૂંટણી ઓળખ કાર્ડ, પાસપોર્ટ)

જાયત છે. પ્રાંગિયની લાંગ્યન્ત વૃદ્ધાને આપળ કાંડે, માતવાઇ? માં કહ્યાં કહ્યાં વીકી અને અને ત્યાં કહ્યાં કહ્યા કહ્યાં કહ્યા કહ્યા કહ્યાં કહ્યાં કહ્યાં કહ્યાં કહ્યાં કહ્યાં કહ્યા

૩૧મી એજએમ હેતુ માટે કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સકર બુક ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦થી બુધવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ (બંને દિવસ સહિત) બંધ રહેશે.

. ઉપરોક્ત માહિતી કંપનીના તમામ સભ્યોની જાણ અને લાભ માટે જારી કરવામાં આવી છે અને એમસીએ પરિપત્ર અને સેબીના પરિપત્રન પાલન કરે છે. અક્ષરકેમ (ઈન્ડિયા) લિમિટેડ વર્તી.

સ્થળઃ ઈન્દ્રાંડ, મહેસાણા તારીખઃ ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૦

THE INDIAN WOOD PRODUCTS CO. LTD. Regd. Off: 7th Floor, 9 Brabourne Road, Kolkata – 700 001 CIN L2010WB1919P-L003557 Tel: 8232023820, Fax: 033 22426799 Website: www.inyskatha.com, E-mail: inpho@inyskatha.com TEXMACO RAIL & ENGINEERING LIMITED CIN : L29261WB1998PLC087404 Registered Office: Belgharia, Kolkata-70005i Ph: (033) 2569 1500, Fax: (033) 2541 2448 site : www.texmaco.in, Email : texrail_cs@texr

Website: www.texmaco.in, Email: texnal Log@texmaco.in
NOTICE OF TWENTY-SECOND ANNUAL GENERAL MEETING
ALONGWITH E-VOTING INFORMATION
Notice is hereby given that the Twenty-Second Annual General Meeting
('AGM) of the Members of the Company is scheduled to be held on
Wedenseday, 30th September, 2020 at 2: 20.9 nm. (IST) through
Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM) to
transact the businesses as set forth in the Notice of the AGM cated
17th June, 2020, in compliance with the provisions of the Companies
Act, 2013 ('Act') and the SEBI (Issign Obligations') read with the
Ministry of Corporate Affairs ('MCA') General Circular Nos. 14/2020,
17/2020, 20/20/20 and 22/2020 (hereinafter collectively referred to as
MCA Circularis) and the Securities and Exchange Board of India circular
no. SEBIH-HOCFD/CMD1/GRIP/2020/79 ('SEBI Circular').

10. SEBIND/CPD/CMD INCREPZZZZZZY/9 (SEB) circular). The Members will be able to attend the AGM of the Company through VC and their presence through the VC facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

n compliance with the above mentioned provisions and circulars he Notice of the AGM and the Annual Report have been sent or the September, 2020 to those Members whose email addresses are registered with the Company / Depository Participant(s)/ Registrar & Share Transfer Agent ('RTA').

The Notice and the Annual Report are also available on the website of the Company at www.texmaco.in, on the website of RTA at evoting.karvy.com and on the website of the Stock Exchanges where the Equity Shares of the Company are listed at www.bseindia.com, and www.nseindia.com.

and www.nsemida.com.

In compliance with the provisions of Section 198 of the Act read with rules framed thereunder and the Listing Regulations, the Company shall provide e-voting facility to its Members enabling them to cast their votes electronically through remote e-voting for all the Resolutions as set out in the Notice of the AGM. The Company has availed the services of Ms KFin Technologies Private Limited, who is also the RTA, (KFin), to facilitate e-voting and to conduct the AGM through VC.

The remote e-voting period shall commence on Saturday, 26th September, 2020 (9:00 a.m.) and end on Tsueday, 28th September, 2020 (9:00 a.m.) and end on Tsueday, 28th September, 2020 (9:00 a.m.) and red on Tsueday, 28th September, 2020 (9:00 a.m.) and remote e-voting shall not be allowed beyond the said date and time. The Voting rights of Members will be reckoned on the paid-up value of Equity Shares registered in the name of the Members as on Thursday, 24th September, 200 (cut-off date), only those Members whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Coverns anniatinate by the Depositores as on the cut-off date will be entitled to cast their votes.

A Member may participate in the AGM through VC / OAVM by following

as on the qu-off date will be entitled to cast their votes. Admither may participate in the ACM through VC / OAVM by following the procedure as stated in the Notice of the ACM, even after exercising this Principate to vote through remote e-voling but shall not be allowed to vote again during the ACM. The Company will also be providing the facility of e-voling (instapolit) during the ACM. The persons who have acquired Equity Shares and became Members of the Company after dispatch of the Notice may obtain their User ID and Password for remote e-voting either by approaching KFin by sending an email to einward.rise@fintech.com or by following the procedure as mentioned in the Notes to the Notice of the ACM. The Members are requested to carefully read the instructions perfaining to e-voting and attending the ACM through VC/OAVM as provided in the Notice.

n case of any query regarding e-voting or technical assistance for C/OAVM participation, members may contact Mr. Raj Kumar Kale, an fficial of KFin at 040-67162222 or the toll free no. 1800-345-4001 or

wine at evolungigammech.com.

The Results of the e-voling will be declared on or after the date of the AGM i.e. Wednesday, 30th September, 2020. The declared Results along with the Scrutilizer's Report and further details, if any will be available on the Company's website at www.texmaco.in, on the website of KFirin at evoting karry.com and on the website of the Slock Exchanges, where the Equity Shares of the Company are listed at www.bseindla.com and www.nseindla.com.

By order of the Board of Directors and www.nseindla.com. By order of the Board of Director

Place: Kolkata Ravi V. Date: 7th September, 2020 Company Secretary & Compliance O

વાડિલાલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

જીસ્ટર્ક ઓફીસ : વાડીલાલ હાઉરા, પત્ર શ્રીમાળી સોસાચટી, નવરંગપુરા પોલીસ સ્ટેશન પ ફોન : ૦૭૯—રદુપદુ૪૦૧૯ શ્રી ૨૪, ફેક્સ : ૨૬૫૬૪૦૨૭, **CIN** : L91110G.

૩૬મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ બુકબંધ અને રીમોટ ઇ-વોટીંગ મા<u>હિ</u>તી

ત્રાથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૬મી વાર્ષિક સામાન્ય સભા **બુઘવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦** ન <mark>શેજ સવારે ૧૧:૦૦ કલાકે</mark> વિશિયો કોન્ફરન્સીંગ (''વીસી'')/ અન્ય ઓડિયો વિઝ્યુર્જલ માધ્યમો (''ઓએવીએમ'') દ્વાઃ શરીખ ૩૧મી ઓત્રસ્ટ, ૨૦૨૦ ની એજીએમની નોટીસમા જણાવેલ કાર્યો પાર પાડવા યાટે યોજાશે.

કોવીડન ૯ મહાયાશીને ધ્યાનમાં રાખીને, કોર્યોરેટ અફેર્સ મત્રાલય (એમસીએ)એ તેના પરિપત્ર તારીખ પ મે, ૨૦૨૦ સાથે રંચાતા પરિપત્ર તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ અને ૧૩ એપ્રિલ, ૨૦૨૦ (સંયુક્ત રીતે 'એમસીએ પરિપત્રો 'તરીકે દર્શાવેલ છે હ્રારા એક જ સ્થળે સભ્યોની શારીરિક હાજરી વગર વીસી અથવા ઓએવીએમ દ્વારા એજીએમ યોજવાની પરવાનગી આપી છે તાલ એક હું રુપ્ય સામ્યાના મહાના કેટ લાક માન રહ્યા અપના માનાબંગ કહ્યું છે. જેવાના મહત્યા મેં રચ્યાં માના આ કોઈ આ એમસીએ પરિપત્રો અને કંપની કાયછા, ૨૦૧૩ ની સમર્થિલ જોગવાળકો તેમજ સંબી (સિસ્ટરીંગ ઓલ્પોરિયસ્ત્ર અંદિ સિક્લોઝર રીક્લાયરમેન્ટ્રસ) નિયમનો, ૨૦૧૫ ના અનુપાલન હેઠળ કંપનીના સભ્યોની વાર્ષિક સામાન્ય સભા વીસી બ્રોએવીએમ ક્રારા યોજાશે. સભ્યો વીસી / ઓએવીએમ ક્રારા એજીએમમાં હાજર રહી શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં ક્ષે હવાની સચનાઓ એજીએમની નોટીસમાં આપેલ છે. વીસી / ઓએવીએમ દ્વારા સભામાં હાજર રહેનાર સભ્યોની કંપનં યદા, ૨૦૧૩ ની કલમ ૧૦૭ હેઠળ કોરમની ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

કાયદા. તે હેઠળ સ્થાયેલ નિયમો અને ઉપરોક્ત પરિપત્રોના પાલન હેઠળ. કંપની ૩૬મી એજીએએમની નોટીસ. ઇ–વોટીંગ કુચનાઓ અને નાણાંકિય વર્ષ, ૨૦૧૯–૨૦ નો વાર્ષિક અહેવાલ કંપની અથવા રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ અથ ડેપોઝીટરી પાર્ટીથીપન્ટ(ટો)પાસે જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨ ાા રોજ મોકલેલ છે. એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રો દ્વારા એજી એમની નોટીસની ફીઝીકલ નકલો મોકવાની ૪રૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. નાણાંક્રિય વર્ષ ૨૦૧૯–૨૦ ના વાર્ષિક અહેવાલ તેમજ એજીએમની નોટીસ રુપાનીનો વેશસાઇટ <u>www.vadilalgroup.com</u> સ્ટોક એક્સચેન્જની વેશસાઇટ <u>www.bseindia.com</u> અને www.nseindia.com અને સેન્ટ્રલ પ્રિયોઝિટી સર્વિસીઝ લીમીટેડ (સીડીએસએલ) ની વેશસાઇટ <u>www.evotingindia.com</u> પર ઉપલબ્ધ એશે.

ાંથી (સિસ્ટીંગ ઓલ્લોગેશન્સ અને દ્રિપ્રક્લોઝર રીક્વાયરમેન્ટ્રમ) નિયમનો, ૨૦૦૧ પના નિયમન ૪૪(૧) મુજબ, કંપની તેના હત્યોને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ (સીડીએસએલ) દ્વરા નોટીસમાં જણાવેલ ઠરાવો પર ઇલેક્ટ્રોનિક હાથમો (રીમોટ ઇન્વોર્ટીગ) દ્વરા તેમના યત્ત આપવાની સવલત આપતા આનંદ અનુભવે છે. રીમોટ ઇન્વોર્ટીગનો સમયગાળી વિવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ (સવારે ૯:૦૦ કલાકે)શરૂ થશે અને મંગળવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ (**સાંજે પ:૦૦ કલાકે)** પૂર્ણ થશે. આ ગાળા દરમિયાન અને વાર્ષિક સામાન્ય સભાના સમયે, કંપનીના શેરહોલ્ડરો ઇલેક્ટ્રોનિક રીતે તેમના મત આપી શકશે. ત્યારબાદ વોર્ટીંગ માટે સીડીએસએલ દ્વારા છ–વોર્ટીંગ મોડ્યુલ બંધ કરવામાં આવશે.

ભ્યોના વોટીંગ હકો કટ–ઓફ તારીખ ૨૩ **સપ્ટેમ્બર, ૨૦૨૦** ના રોજ કંપનીની ભરપાઇ થયેલ શેર મુડીના તેમના હિસ્સા ાનુરૂપ રહેશે. નોટીસની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર ચ રેંગ્ર સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ શેરો ધરાવતી કોઇપણ વ્યક્તિ <u>helpdesk evoting@cdslindia.com</u> પ અરજી મોકલીને લોગીન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. જે સભ્યોએ તેમના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવ્યા નથી તેમને કંપની અથવા રજીસ્ટ્રાર અથવા શેર ટ્રાન્સકર એજન્ટ અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે તેમના ઇમેઇલ એડ્રેસ નોંધાવવ

મેજીએમમાં હાજર રહેનાર જે સભ્યોએ રીમોટ ઇ-વોટીંગથી મત આપ્યા નથી તેઓ એજીએમ દરમિયાન ઇ-વોટીંગથી તેમ મત આપવા હકદાર ગણાશે. જે સભ્યોએ રીમોટ ઇ-વોર્ટીંગથી તેમના મત આપ્યા છે તેઓ એજીએમમાં હાજર રહેવા હકદા ાણાશે. આમ છતાં, તેઓ સભામાં મત આપવા હકદાર ગણાશે નહી. ઇલેક્ટ્રોનિક વોટીંગ (ઇ–વોટીંગ)ની પ્રક્રિયા એજીએમન્ ોટીસમાં આપેલ છે.

કંપની કાયદા. ૨૦૧૩ ની કલમ ૯૧. કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન)નિયમો. ૨૦૧૪ ના નિયમ ૧૦ અને સેબી (લિસ્ટી ોબ્લીગેશન્સ અને જ્ઞિકલોઝર રીક્તાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૨ અન્વયે અહી નોટીસ આપવામાં આ કે કંપનીના રજીસ્ટર ઓક મેમ્બર્સ અને શેર ટ્રાન્સકર બુક્સ ૨૧**મી સપ્ટેમ્બર, ૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦** સુર્ધ (બંને દિવસો સહીત) ૩૧મી માર્ચ, ૨૦૨૦ ના પુરા થતાં વર્ષની વાર્ષિક સામાન્ય સભાના હેતુસર બંધ રહેશે

જો તમને સભામાં હાજર રહેવા અથવા ઇ–વોટીંગ સંબંધિત કોઇ પ્રશ્નો અથવા સમસ્યા હોય તો, helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ મોકલી શકો છો અથવા ૧૮૦૦૨૨૫૫૩૩ પર કોલ કરી

ઇલેક્ટોનિક માધ્યમો દ્વારા વોટીંગ સાથે સંકળાયેલ કરિયાદો માટે જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો નીચે મજબ છે શ્રીમતી રશ્નિ ભક્ષ, કંપની સેક્રેટરી, ફોન : ૦૭૯-૪૮૦૮૧૨૦૦, ઇમેઇલ : <u>shareslogs@vadilalgroup.com</u>

> વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સહી/ ગજેશ આગ ગાંદી Place : Mumbai Dated : September 7, 2020 મેનેજીંગ કિરેક્ટર

Reliance Retail Limited

CIN: U01100MH1999PLC120563

Regd. Office: 3rd Floor, Court House, Lokmanya Tilak Marg,
Dhobi Talao, Mumbai - 400 002

Phone: +91-22-3555 3800 • E-mail: retail.secretarial@ril.com
Website: www.relianceretail.com

INFORMATION REGARDING TWENTY-FIRST ANNUAL GENERAL MEETING

- The Twenty-first Annual General Meeting ("AGM") of Reliance Retail Limited ("the Company") will be held through Video Conferencing Meeting ("AGM") of Reliance Retail Limited ("the Company") will be held through Video Conferencing September 30, 2020 at ±190 a.m. 151, in compliance with all the oppicable provisions of the Companies Azt. 2013 and the Rules made thereunder read with General Circular No. 12/020 dated Amil 13, 2000 and General Circular No. 20/220 dated Amil 13, 2000 and General Circular No. 20/220 dated May 15, 2020, and other politicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") (collectively referred to as "MCA circulars"), to transact the business set out in the Notice Calling the AGM. Members will be able to attend the AGM through VC / OAVM. Members participating frough the VC / OAVM Merality shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- quorum under Section 103 of the Componies Act, 2013.

 In compliance with the MCA circuits, the Notice of the AGM and the standalone and consolidated financial statements for the financial year 2019-20, along with Board is Report, Auditors is Report and other documents required to be attached thereto, will be sent to all the Members of the Company whose emil addresses are registered with the Company is Company whose emil addresses are registered with the Company is People and the Company is Website at www.relianceretali.com and on the website of Company's Registrar and Transfer Agent, Kfin Technologies Private Limited ("KFinTech"), at https://evoting.kfintech.com.
- Manner of registering / updating email addresses:
 - Manner or registeringly appointing manu accesses: (a) Members halding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company, are requested to register / update the same by writing to the Company with details of folio number and attaching a self-attested copy of PAN card at retail.secretarial@ril.com or to Ki'ni ledu turlimvestor@Kintech.com.
 - Members holding shares in dematerialised mode, who have not registered / updated their email addresses with their Depository Participants, are requested to register / update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts.
- Manner of casting vote(s) through e-voting:
- (b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in demoterabilities and one physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company at www.relanceretail.com and on the website of NFINTECh at https://evoling.kintech.com.
- The facility for voting through electronic voting system will also be mode available at the AGM ("Insta Poli") and Members attending the AGM who have not cast their vote(s) by remote evoting will be able to vote at the AGM through Insta Poli.
- voting will be done to voted the Aust includy in its at val.

 The login credentials for casting votes through e-voting shall be made available to the members through email. Members who do not receive email or whose email addresses are not registered with the Company / KFinTech / Depository Polytopart(s), may generate login credentials by following instructions given in the Notes to Notice of AGM.
- The same login credentials may also be used for att AGM through VC / OAVM.
- embers are requested to carefully read all the Notes set out in Notice of the AGM and in particular, instructions for joining AGM, manner of casting vote through remote e-voting or ough Insta Poll during the AGM.

By order of the Board of Dire K. Sridhar Company Secretary

નારીખ : ૦૫.૦૯.૨૦૨૦ સ્થળ : અમદાવાદ